Regd. Office :-

330, TRIVIA Complex, Natubhai Circle,

Racecourse, Vadodara - 390007, Gujarat, INDIA

Phone: +91 265 2988903 / 2984803 Website: www.chemcrux.com Email: girishshah@chemcrux.com





CIN: L01110GJ1996PLC029329

13th August 2022

Corporate Relations Department BSE LIMITED,

Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400 001

Dear Sir/Madam.

Subject: Publication of Standalone Unaudited Financial Results for the Quarter ended 30th June

Ref:

BSE Scrip ID: CHEMCRUX BSE Scrip Code: 540395

Pursuant to Regulation 30 & 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper publication of Standalone Unaudited Financial Results of the Company for the Quarter ended 30th June 2022 published in Business Standard (English) & Loksatta Jansatta (Gujarati) Newspapers on Saturday, 13th August 2022.

Kindly take the above on your record.

Yours faithfully,

For, CHEMCRUX ENTERPRISES LIMITED

Dipika Rajpal

Company Secretary & Compliance Officer



SPML INFRA LIMITED

CIN: L40106DL1981PLC012228

Registered Office: F-27/2, Okhla Industrial Area, Phase-II, New Delhi- 110020

Website: www.spml.co.in, email-id: cs@spml.co.in

Extract of Standalone and Consolidated Unaudited Financial Results for the First Quarter ended 30th June, 2022

Extraor 0	Otalidalo	ne and oo	iisoiidated	011	addited i mancial results for the i list	additor on	ueu oo ou	iie, zozz	(Rs. in Lakhs)
	STANDA	LONE					CONSO	LIDATED	
	Quarter Ende	d	Year Ended				Quarter Ended		Year Ended
30.06.2022	31.03.2022	30.06.2021	31.03.2022		PARTICULARS	30.06.2022	31.03.2022	30.06.2021	31.03.2022
(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)			(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
12,767.95	22,798.95	18,302.46	85,309.69	1.	Total income from operations	12,913.05	24,174.05	18,530.69	95,177.28
129.84	631.03	(783.13)	886.03	2.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	63.82	(508.27)	(704.55)	(192.88)
129.84	631.03	(783.13)	886.03	3.	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	63.82	(508.27)	(704.55)	(192.88)
77.55	367.24	(251.08)	998.06	4.	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	42.17	(598.87)	(185.38)	32.19
90.14	362.21	(220.36)	976.87	5.	Total Comprehensive Income for the period	54.76	(603.91)	(154.66)	10.99
940.04	874.95	819.45	874.95	6.	Equity Share Capital		874.95	819.45	874.95
				7.	Earnings Per Share (of Rs.2/- each) in Rs.				
0.17	0.82	(0.69)	2.68		Basic & Diluted	0.09	(1.61)	(0.51)	0.09
# The Comp	any does not	have any Exc	entional and F	ytra	ordinary items to report in above periods				

any does not have any Exceptional and Extraordinary items to report in above periods

. The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the 1st quarter ended 30th June 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone and Consolidated Financial Results for the 1st quarter ended 30th June, 2022 are available on the websites of the Stock Exchange(s) i.e NSE at www.nseindia.com and BSE at www.bseindia.com and the Company's website www.spml.co.in

2. The Unaudited Standalone and Consolidated Financial Results for the 1st quarter ended 30th June, 2022 was approved by the Audit Committee and the Board of Directors of the Company in their respective meetings held on 11th August, 2022

For SPML Infra Limited

Dated: 12th August, 2022 Place: Kolkata

Subhash Chand Sethi Chairman DIN: 00464390

HB PORTFOLIO LIMITED

CIN: L67120HR1994PLC034148 Registered Office: Plot No. 31, Echelon Institutional Area, Sector 32, Gurugram - 122001, Haryana

Phone: +91-124-4675500 Fax: +91-124-4370985 E-mail: corporate@hbportfolio.com, Website: www.hbportfolio.com

STATEMENT OF QUARTERLY FINANCIAL RESULTS (STANDALONE AND CONSOLIDATED) FOR THE QUARTER ENDED 30/06/2022

(RS. In Laki									
S.	Particulars		Standalone			Consolidated			
No.		Quarter	Corresponding	Year	Quarter	Corresponding	Year		
		ended	3 months	ended	ended	3 months	ended		
			ended in the			ended in the			
			previous year			previous year			
		30/06/2022	30/06/2021	31/03/2022	30/06/2022	30/06/2021	31/03/202		
		Un-audited	Un-audited	Audited	Un-audited	Un-audited	Audited		
1.	Total Income from Operations (net)	360.53	8.37	161.97	668.43	548.22	1856.92		
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	301.13	(31.97)	(56.41)	240.90	300.86	672.58		
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	301.13	(31.97)	(56.41)	240.90	300.86	672.5		
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	300.51	(32.57)	(55.12)	222.98	286.70	645.7		
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(877.33)	4542.69	4372.18	(1039.57)	4982.67	5396.6		
6.	Equity Share Capital	1076.42	1076.42	1076.42	1076.42	1076.42	1076.43		
7.	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	NA	NA	16343.67	NA	NA	19417.5		
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)-								
	Basic:	2.79 2.79	(0.30)	(0.51)	2.06 2.06	2.62 2.62	5.83 5.83		
	Diluted:	2.79	(0.30)	(0.51)	2.00	2.02	0.8		

- (i) The above is an extract of the detailed format of the Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the website of Stock Exchange, BSE Limited, www.bseindia.com and Company's website, www.hbportfolio.com
- (ii) The aforesaid results were placed before and reviewed by the Audit Committee at its meeting held on 12th August, 2022 and approved by the Board of Directors at its meeting held on the same date.

For HB Portfolio Limited ANIL GOYAL

Place: Gurugram (Managing Director) DIN: 00001938 Date: 12/08/2022



CHEMCRUX ENTERPRISES LIMITED

CIN: L01110GJ1996PLC029329

Regd. Off.: 330, TRIVIA Complex, Natubhai Circle, Racecourse, Vadodara - 390007 Email: girishshah@chemcrux.com Ph.: 0265-2984803/2988903 Website: www.chemcrux.com EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2022 (Rs. in lakhs except EPS)

	Stand	aaione
Particulars	Quarter ended 30/06/2022 (Unaudited)	Quarter ended 30/06/2021 (Unaudited)
Total income from operations (net)	2,714.58	1,638.71
Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items)	516.80	285.42
Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items)	516.80	285.42
Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items)	383.06	200.31
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss)for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	385.49	203.21
Paid up Equity Share Capital (Face Value Rs 10 each)	1480.88	1480.88
Other equity excluding revaluation reserve	-	-
Earnings per share (of Rs.10/- each)		
1. Basic (in Rs.)	2.59	1.35
2. Diluted (in Rs.)	2.59	1.35
	Total income from operations (net) Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items) Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items) Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss)for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Paid up Equity Share Capital (Face Value Rs 10 each) Other equity excluding revaluation reserve Earnings per share (of Rs.10/- each) 1. Basic (in Rs.)	Particulars Quarter ended 30/06/2022 (Unaudited) Total income from operations (net) Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items) Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items) Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items) Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss)for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Paid up Equity Share Capital (Face Value Rs 10 each) Other equity excluding revaluation reserve Earnings per share (of Rs.10/- each) 1. Basic (in Rs.)

Notes:
1. The above unaudited standalone financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 12th August 2022. The figures for the quarter ended 30th June 2022 have been subjected to limited review by the statutory auditors.

- Since the Company was listed on BSE SME Exchange till the end of previous year, it was not preparing quarterly financial results. However, in order to meet the requirements of SEBI Listing Regulations for financial results, the Company has prepared the quarterly financial results for the first quarter of FY 2021-22 and made them Ind AS Compliant. Such Ind AS compliant figures relating to the first quarter of the previous year have not been subjected to review/audit by the Auditors and have been prepared and presented solely based on the information provided by the management. However, the Company's management has exercised necessary due diligence to ensure that such financial results provide a true and fair view of its affairs.
- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock Exchange (BSE) under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange website at www.bseindia.com & company's website at www.chemcrux.com.

For CHEMCRUX ENTERPRISES LIMITED

Place: Vadodara Date: 12th August 2022 Girishkumar Shah (Whole Time Director) (DIN:00469291)

Place: Hyderabad

Date: 12.08.2022

KAIROS PROPERTY MANAGERS PRIVATE LIMITED

CIN: U74999MH2017PTC292512

REGD. OFFICE: 4th Floor, A-401, 402, Delphi A, Orchard Avenue, Powai, Mumbai Suburban, Maharashtra, 400076. Website: www.kairosproperty.co.in, Tel: +91-124-3821400, Email: kairos.legal@brookfield.com

UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2022

Regulation 52(8) read with Regulation 52(4) of the SEBI (LODR) Regulations, 2015

For the For the

Particulars	quarter ended 30 June 2022	quarter ended 31 March 2022		ended 31 March 2022
	(INR million) STANDALONE	(INR million) STANDALONE	(INR million) STANDALONE	(INR million) STANDALONE
	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED
1. Total income from Operations	64.72	62.46	58.90	244.02
Net Profit / (Loss) for the period (before tax,				
Exceptional and/or Extraordinary items)	(524.54)	(540.19)	(362.55)	(1,833.02)
Net Profit / (Loss) for the period before tax(after				
Exceptional and/or Extraordinary items)	(524.54)	(540.19)	(362.55)	(1,833.02)
Net Profit / (Loss) for the period after tax(after				
Exceptional and/or Extraordinary items)	(524.54)	(542.33)	(362.55)	(1,836.26)
5. Total Comprehensive Income for the period				
[Comprising Profit / (Loss) for the period (after tax)		4= 4= 4=1	(
and Other Comprehensive Income (after tax)]	(524.39)	(542.19)	(362.53)	(1,835.92
Paid-up equity share capital	07.50	07.50		07.50
(Face value INR 10 per share)	97.59		97.59	97.59
7. Reserves (excluding Revaluation reserve)	(5,844.63)		(3,844.08)	(5,320.24
8. Net Worth	(5,747.04)		(3,746.49)	(5,222.65
Paid up debt capital / outstanding debt	22,442.68	21,722.49	19,544.97	21,722.49
10. Outstanding Redeemable Preference Shares	(0.04)	(4.40)	/F 00\	/4.40
11. Debt Equity ratio*	(3.91)	(4.16)	(5.22)	(4.16
12. Loss per share (before other comprehensive income)				
(in INR)#	(40.74)	(40.76)	(05.40)	(444.77
a) Basic	(40.71)		(25.12)	(141.77
b) Diluted	(40.71)	(48.76)	(25.12)	(141.77
Capital Redemption Reserve Debenture Redemption Reserve				
15. Debt Service Coverage Ratio	NA.	NA.	NA NA	N/
16. Interest Service Coverage Ratio	0.12		0.30	0.19
10. Interest dervice deverage Ratio	0.12	0.04	0.30	0.18

not annualised for the quarter ended 30 June 2022, 31 March 2022 and 30 June 2021.

- The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quartrely financial results are available on the websites of the Stock Exchange(s) and the listed entity (www.bseindia.com) and the Company (www.kairosproperty.
- 2. For the items referred in sub-clauses (m), (n), (o), (p), (q), (r), (s), (t), (u) and (v) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange (Bombay Stock Exchange) and can be accessed on the URL (www.bseindia.com) and the Company (www.kairosproperty.co.in).
- Kairos Property Managers Private Limited ("the Company") has become subsidiary of Project Diamond Holdings (DIFC ("the Parent Company") w.e.f. 23 August 2021 (Till 22 August 2021, the Company was subsidiary of BSREP II India Office Holdings II Pte. Ltd.). It was incorporated on 16 March 2017. The Company is in the business of providing management related services. including facilities management service and property management services.
- These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as per the Companies (Indian Accounting Standards) Rules, 2015 notified under Section 133 of Companies Act, 2013, ("the Act") and other relevant provisions of the Act and have been reviewed and approved by the Board of Directors at their meeting held on the 12 August 2022.

For and on behalf of the Board of Directors of Kairos Property Managers Private Limited Pallavi Sadashiv Chaudhari

Place: Mumbai Date: 12 August 2022 Managing Director DIN: 09555939



Regd. Off.: 37, First Floor, Kamala Bhavan II, S Nityanand Road, Andheri (East), Mumbai - 400 069.
Tel.: (91-22) 6726 1000 • CIN: L24100MH1984PLC033519 • Web: www.guffc.com • Email: corporaterelations@guffcbio.com • Fax: 022 6726 1068

esults for t	he Quarte	r ended 30	.06.2022
		Rupees in La	khs (Except EPS)
	For Quarter E	nded	For Year Ended
30.06.2022 (Un- Audited)	31.03.2022 (Audited)	30.06.2021 (Un-Audited)	31.03.2022 (Audited)
16,527.63	16,219.31	25,075.77	77,915.56
2,828.03	2,617.63	4,154.11	12,683.83
2,828.03	2,617.63	4,154.11	12,683.83
2,105.15	2,026.42	3,120.70	9,584.01
2,105.15	1,982.36	3,120.70	9,539.95
969.45	969.45	969.45	969.45
	-	-	25,942.35
2.17	2.09	3.22	9.89
2.17	2.09	3.22	9.89
	30.06.2022 (Un- Audited) 16,527.63 2,828.03 2,828.03 2,105.15 2,105.15	For Quarter Et 30.06.2022 (Un- Audited) 31.03.2022 (Audited) 16,527.63 16,219.31 2,828.03 2,617.63 2,828.03 2,617.63 2,105.15 2,026.42 2,105.15 1,982.36 969.45 969.45 2.17 2.09	Social Content

a) The above financials have been prepared in accordance with the Companies (Indian Accounting Standards), Rules, 2015 (Ind AS) as amended, prescribed under Section 133 of the Companies Act, 2013 read with rules issued thereunder.

- The above extract of Un-Audited Financial Results of the Companies Act, 2013 read with the sassed interesting.

 The above extract of Un-Audited Financial Results of the Company have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on Thursday, August 11, 2022. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the same. The same is available on website of the Company at www.guflic.com and on the website of BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com where shares of the Company are listed.
- c) Previous period/year's figures have been reclassified/regrouped wherever necessary to confirm with the current account

Date: August 12, 2022 Place: Mumbai

By order of the Board of Directo For Gufic Biosciences Limited

Pranav J. Choksi CEO & Whole Time Director DIN: 00001731

EXPLORE INNOVATE INVENT

Astra Microwave Products Limited

Regd. office: Astra Towers, Survey No: 12(Part), Opp. CII Green Building, Hitech City, Kondanur, Hyderahad, Telangana, India -500038 Phone: +91-040-46618000, 46618001, Fax: +91-040-46618048 Email: info@astramwp.com, Website: www.astramwp.com, CIN: L29309TG1991PLC013203



(Rs. Lacs)

EXTRACT OF THE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2022 IN COMPLIANCE WITH THE INDIAN ACCOUNTING STANDARDS (IND AS)

Consolidated Standalone Quarter ended Quarter ended Quarter ended Quarter ended Year ended Quarter ended Year ended **Particulars** Quarter ended 31.03.2022 30.06.2022 31.03.2022 30.06.2021 31.03.2022 30.06.2021 31.03.2022 30.06.2022 1. Total income from operations 16,116.17 23,888.48 12,019.76 73,496.29 16,207.63 23,943.88 12,880.88 75,046.31 2. Net Profit / (Loss) for the period (before Tax, 1,514.32 2.076.56 1,213.68 5,273.88 1,272.94 1,672.26 1,589.49 5.246.30 exceptional and Extraordinary Items) 3. Net Profit / (Loss) for the period before Tax 1.514.32 2.076.56 1.213.68 5.273.88 1.174.40 1.557.72 1.509.47 5.021.15 (after exceptional and extraordinary Items) 1,557.01 4. Net Profit / (Loss) for the period after Tax 4.028.62 1.090.05 3,787.07 1,142.60 966.20 810.16 1.217.31 (after exceptional and extraordinary Items) 5. Total Comprehensive Income for the period 1,124.54 1,395.24 969.75 3,956.37 818.06 936.52 1,224.47 3,727.63 (Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)) 6. Equity Share Capital 1732.23 1732.23 1732.23 1732.23 1732.23 1732.23 1732.23 1732.23 7. Other Equity 57,236,32 56.826.57 8. Earnings Per Share (of Rs. 2/-each) Basic: 1.32 1.80 1.12 4.65 0.94 1.26 1.41 4.37 1.32 1.80 1.12 4.65 0.94 1.26 1.41 4.37

Notes: The above is an extract of the detailed format of quarter ended 30th June, 2022 financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended 30th June, 2022 financial results are available on the Websites of stock exchanges (www.bseindia.com) and (www.nseindia.com) and on the Company's website (www.astramwp.com).

The above results are in accordance with the Indian Accounting Standards (IND AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder.

For and on behalf of the Board of Directors

www.astramwp.com

Dr. Avinash Chander





SPML INFRA LIMITED

CIN: L40106DL1981PLC012228

Registered Office: F-27/2, Okhla Industrial Area, Phase-II, New Delhi- 110020

Website: www.spml.co.in, email-id: cs@spml.co.in

	STANDA	LONE					CONSO	LIDATED	Year Ended
	Quarter Ende	d	Year Ended			9	Quarter Ende	t	
30.06.2022	31.03.2022	30.06.2021	31.03.2022		PARTICULARS 30.06.2022 31.03.2022 30.00		30.06.2022 31.03.2022 30.06.2021		31.03.2022
(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)			(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
12,767.95	22,798.95	18,302.46	85,309.69	1.	Total income from operations	12,913.05	24,174.05	18,530.69	95,177.28
129.84	631.03	(783.13)	886.03	2.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	63.82	(508.27)	(704.55)	(192.88)
129.84	631.03	(783.13)	886.03	3.	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	63.82	(508.27)	(704.55)	(192.88)
77.55	367.24	(251.08)	998.06	4.	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	42.17	(598.87)	(185.38)	32.19
90.14	362.21	(220.36)	976.87	5.	Total Comprehensive Income for the period	54.76	(603.91)	(154.66)	10.99
940.04	874.95	819.45	874.95	6.	Equity Share Capital	940.04	874.95	819.45	874.95
				7.	Earnings Per Share (of Rs.2/- each) in Rs.				
0.17	0.82	(0.69)	2.68		Basic & Diluted	0.09	(1.61)	(0.51)	0.09

Extract of Standalone and Consolidated Unaudited Financial Results for the First Quarter ended 30th June, 2022

The Company does not have any Exceptional and Extraordinary items to report in above periods

I.The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the 1st quarter ended 30th June 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone and Consolidated Financial Results for the 1st quarter ended 30th June, 2022 are available on the websites of the Stock Exchange(s) i.e NSE at www.nseindia.com and BSE at www.bseindia.com and the Company's website www.spml.co.in

2.The Unaudited Standalone and Consolidated Financial Results for the 1st quarter ended 30th June, 2022 was approved by the Audit Committee and the Board of Directors of the Company in their respective meetings held on 11th August, 2022

For SPML Infra Limited

Dated: 12th August, 2022 Place: Kolkata

Subhash Chand Sethi Chairman DIN: 00464390

B HB PORTFOLIO LIMITED

CIN: L67120HR1994PLC034148 Registered Office: Plot No. 31, Echelon Institutional Area, Sector 32, Gurugram - 122001, Haryana Phone: +91-124-4675500 Fax: +91-124-4370985


E-mail: corporate@hbportfolio.com, Website: www.hbportfolio.com STATEMENT OF QUARTERLY FINANCIAL RESULTS (STANDALONE AND CONSOLIDATED) FOR THE QUARTER ENDED 30/06/2022

S.	Particulars		Standalone			Consolidated	
No.		Quarter ended	Corresponding 3 months ended in the previous year	Year ended	Quarter ended	Corresponding 3 months ended in the previous year	Year ended
		30/06/2022	30/06/2021	31/03/2022	30/06/2022	30/06/2021	31/03/2022
		Un-audited	Un-audited	Audited	Un-audited	Un-audited	Audited
1.	Total Income from Operations (net)	360.53	8.37	161.97	668.43	548.22	1856.92
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	301.13	(31.97)	(56.41)	240.90	300.86	672.58
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	301.13	(31.97)	(56.41)	240.90	300.86	672.58
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	300.51	(32.57)	(55.12)	222.98	286.70	645.71
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(877.33)	4542,69	4372.18	(1039.57)	4982.67	5396.61
6.	Equity Share Capital	1076.42	1076.42	1076.42	1076.42	1076.42	1076.42
7.	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	NA	NA	16343.67	NA	NA	19417.50
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)-						
	Basic:	2.79	(0.30)	(0.51)	2.06	2.62	5.83
	Diluted:	2.79	(0.30)	(0.51)	2.06	2.62	5.83

- (i) The above is an extract of the detailed format of the Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the website of Stock Exchange, BSE Limited, www.bseindia.com and Company's website, www.hbportfolio.com
- (ii) The aforesaid results were placed before and reviewed by the Audit Committee at its meeting held on 12th August, 2022 and approved by the Board of Directors at its meeting held on the same date.

For HB Portfolio Limited ANIL GOYAL

Place : Gurugram (Managing Director) DIN: 00001938 Date: 12/08/2022



Regd. Off.: 330, TRIVIA Complex, Natubhai Circle, Racecourse, Vadodara - 390007 Email: girishshah@chemcrux.com Ph.: 0265-2984803/2988903 Website: www.chemcrux.com EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2022 (Rs. in lakhs except EPS)

		Stan	dalone
Sr. No.	Particulars	Quarter ended 30/06/2022 (Unaudited)	Quarter ended 30/06/2021 (Unaudited)
1	Total income from operations (net)	2,714.58	1,638.71
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items)	516.80	285.42
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items)	516.80	285.42
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items)	383.06	200.31
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss)for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	385.49	203.21
6	Paid up Equity Share Capital (Face Value Rs 10 each)	1480.88	1480.88
7	Other equity excluding revaluation reserve	12	-
8	Earnings per share (of Rs.10/- each) 1. Basic (in Rs.)	2.59	1.35
	2. Diluted (in Rs.)	2.59	1.35

Notes:
1. The above unaudited standalone financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 12th August 2022. The figures for the quarter ended 30th June 2022 have been subjected to limited review by the statutory auditors.

Since the Company was listed on BSE SME Exchange till the end of previous year, it was not preparing quarterly financial results. However, in order to meet the requirements of SEBI Listing Regulations for financial results, the Company has prepared the quarterly financial results for the first quarter of FY 2021-22 and made them Ind AS Compliant. Such Ind AS compliant figures relating to the first quarter of the previous year have not been subjected to review/audit by the Auditors and have been prepared and presented solely based on the information provided by the management. However, the Company's management has exercised necessary due diligence to ensure that such financial results provide a true and fair view of its affairs.

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock Exchange (BSE) under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange website at www.bseindia.com & company's website at www.chemcrux.com. For CHEMCRUX ENTERPRISES LIMITED

Place: Vadodara Date: 12th August 2022

Girishkumar Shah (Whole Time Director) (DIN:00469291)

KAIROS PROPERTY MANAGERS PRIVATE LIMITED

CIN: U74999MH2017PTC292512

REGD. OFFICE: 4th Floor, A-401, 402, Delphi A, Orchard Avenue, Powai, Mumbai Suburban, Maharashtra, 400076. Website: www.kairosproperty.co.in, Tel: +91-124-3821400, Email: kairos.legal@brookfield.com

UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2022

Regulation 52(8) read with Regulation 52(4) of the SEBI (LODR) Regulations, 2015

Particulars	For the quarter ended 30 June 2022 (INR million)	For the quarter ended 31 March 2022 (INR million)	For the quarter ended 30 June 2021 (INR million)	For the year ended 31 March 2022 (INR million)
	STANDALONE	STANDALONE	STANDALONE	STANDALONE
	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED
Total income from Operations	64.72	62.46	58.90	244.0
Net Profit / (Loss) for the period (before tax,	200000000000000000000000000000000000000	5-1842 (Medical Control	MINISTER STATE	Value (Miller Marie)
Exceptional and/or Extraordinary items)	(524.54)	(540.19)	(362.55)	(1,833.02
Net Profit / (Loss) for the period before tax(after	1227121			100 000
Exceptional and/or Extraordinary Items)	(524.54)	(540.19)	(362.55)	(1,833.02
4. Net Profit / (Loss) for the period after tax(after	(504.54)	(540.00)	(202 55)	(4 000 00
Exceptional and/or Extraordinary items) 5. Total Comprehensive Income for the period	(524.54)	(542.33)	(362.55)	(1,836.2
Comprising Profit / (Loss) for the period (after tax)				
and Other Comprehensive Income (after tax)]	(524.39)	(542.19)	(362.53)	(1,835.9
6. Paid-up equity share capital	(02 1.00)	(0 12.10)	(002.00)	(1,000.0
Face value INR 10 per share)	97.59	97.59	97.59	97.5
7. Reserves (excluding Revaluation reserve)	(5,844.63)	(5,320.24)	(3,844.08)	(5,320.2
3. Net Worth	(5,747.04)	(5,222,65)	(3,746.49)	(5,222.6
9. Paid up debt capital / outstanding debt	22,442.68	21,722.49	19,544.97	21,722.4
10. Outstanding Redeemable Preference Shares	-	-	-	
11. Debt Equity ratio*	(3.91)	(4.16)	(5.22)	(4.1
12. Loss per share (before other comprehensive income)	1.4500000 V		1000000	
in INR)#				
a) Basic	(40.71)	(48.76)	(25.12)	(141.7
b) Diluted	(40.71)	(48.76)	(25.12)	(141.7
13. Capital Redemption Reserve	1,000,000,000	140000000	200-200-200-200-200-200-200-200-200-200	0.0000000000000000000000000000000000000
14. Debenture Redemption Reserve	-	-		
15. Debt Service Coverage Ratio	NA	NA	NA	N
16. Interest Service Coverage Ratio	0.12	0.04	0.30	0.1

not annualised for the quarter ended 30 June 2022, 31 March 2022 and 30 June 2021.

The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quartrely financial results are available on the websites of the Stock Exchange(s) and the listed entity (www.bseindia.com) and the Company (www.kairosproperty.

For the items referred in sub-clauses (m), (n), (o), (p), (q), (r), (s), (t), (u) and (v) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange (Bombay Stock Exchange) and can be accessed on the URL (www.bseindia.com) and the Company (www.kairosproperty.co.in).

Kairos Property Managers Private Limited ("the Company") has become subsidiary of Project Diamond Holdings (DIFC ("the Parent Company") w.e.f. 23 August 2021 (Till 22 August 2021, the Company was subsidiary of BSREP II India Office Holdings II Pte. Ltd.). It was incorporated on 16 March 2017. The Company is in the business of providing management related services. including facilities management service and property management services.

These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as per the Companies (Indian Accounting Standards) Rules, 2015 notified under Section 133 of Companies Act, 2013, ("the Act") and other relevant provisions of the Act and have been reviewed and approved by the Board of Directors at their meeting held on the 12 August 2022.

For and on behalf of the Board of Directors of Kairos Property Managers Private Limited Pallavi Sadashiv Chaudhari Managing Director DIN: 09555939

BIOSCIENCES LIMITED

Regd. Off.: 37, First Floor, Kamala Bhavan II, S Nityanand Road, Andheri (East), Mumbai - 400 069.
Tel.: (91-22) 6726 1000 - CIN: L24100MH1984PLC033519 -Web: www.guffc.com - Email: com - Fax: 022 6726 1068

_			Rupees in La	khs (Except EPS)	
MESSER W		For Quarter E	nded	For Year Ended	
Particulars	30.06.2022 (Un- Audited)	31.03.2022 (Audited)	30.06.2021 (Un-Audited)	31.03.2022 (Audited)	
Total income from operations	16,527.63	16,219.31	25,075.77	77,915.56	
Net Profit / (Loss) for the period before Tax, Exceptional and/or Extraordinary items	2,828.03	2,617.63	4,154.11	12,683.83	
Net Profit / (Loss) for the period before tax after Exceptional and/or Extraordinary items	2,828.03	2,617.63	4,154.11	12,683.83	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	2,105.15	2,026.42	3,120.70	9,584.01	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2,105.15	1,982.36	3,120.70	9,539.95	
Paid-up equity share capital (Face Value of Re. 1/- each)	969.45	969.45	969.45	969.45	
Reserves (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)	2	3828	<u>.</u>	25,942.35	
Earnings Per Share (of Rs. 1/-each) (for continuing and discontinued Operations)-					
Basic:	2.17	2.09	3.22	9.89	
Diluted:	2.17	2.09	3.22	9.89	

a) The above financials have been prepared in accordance with the Companies (Indian Accounting Standards), Rules, 2015 (Ind AS) as amended, prescribed under Section 133 of the Companies Act, 2013 read with rules issued thereunder.

The above extract of Un-Audited Financial Results of the Company have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on Thursday, August 11, 2022. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the same. The same is available on website of the Company at www.guflc.com and on the website of BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com where shares of the Company are listed.

c) Previous period/year's figures have been reclassified/ regrouped wherever necessary to confirm with the current account

Date: August 12, 2022 Place: Mumbai

By order of the Board of Directo For Gufic Biosciences Limited

Sd/-Pranav J. Choksi CEO & Whole Time Director DIN: 00001731

EXPLORE INNOVATE INVENT

Astra Microwave Products Limited

Regd. office: Astra Towers, Survey No: 12(Part), Opp. CII Green Building, Hitech City, Kondapur, Hyderabad, Telangana, India -500038 Phone: +91-040-46618000, 46618001, Fax: +91-040-46618048 Email: info@astramwp.com, Website: www.astramwp.com, CIN: L29309TG1991PLC013203

Place: Mumbai Date: 12 August 2022



(Rs. Lacs)

EXTRACT OF THE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2022 IN COMPLIANCE WITH THE INDIAN ACCOUNTING STANDARDS (IND AS)

		Stan	dalone			Consolid	iated	
Particulars	Quarter ended 30.06.2022 Un-audited	Quarter ended 31.03.2022 Audited	Quarter ended 30.06.2021 Un-audited	Year ended 31.03.2022 Audited	Quarter ended 30.06.2022 Un-audited	Quarter ended 31.03.2022 Audited	Quarter ended 30.06.2021 Un-audited	Year ended 31.03.2022 Audited
Total income from operations	16,116.17	23,888.48	12,019.76	73,496.29	16,207.63	23,943.88	12,880.88	75,046.31
Net Profit / (Loss) for the period (before Tax, exceptional and Extraordinary Items)	1,514.32	2,076.56	1,213.68	5,273.88	1,272.94	1,672.26	1,589.49	5,246.30
 Net Profit / (Loss) for the period before Tax (after exceptional and extraordinary Items) 	1,514.32	2,076.56	1,213.68	5,273.88	1,174.40	1,557.72	1,509.47	5,021.15
Net Profit / (Loss) for the period after Tax (after exceptional and extraordinary Items)	1,142.60	1,557.01	966.20	4,028.62	810.16	1,090.05	1,217.31	3,787.07
 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)) 	1,124.54	1,395.24	969.75	3,956.37	818.06	936.52	1,224.47	3,727.63
6. Equity Share Capital	1732.23	1732.23	1732.23	1732.23	1732.23	1732.23	1732.23	1732.23
7. Other Equity				57,236.32				56,826.57
8. Earnings Per Share (of Rs. 2/-each)				760				700
Basic:	1.32	1.80	1.12	4.65	0.94	1.26	1.41	4.37
Diluted:	1.32	1.80	1.12	4.65	0.94	1.26	1.41	4.37

Notes: The above is an extract of the detailed format of quarter ended 30th June, 2022 financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended 30th June, 2022 financial results are available on the Websites of stock exchanges (www.bseindia.com) and (www.nseindia.com) and on the Company's website (www.astramwp.com).

The above results are in accordance with the Indian Accounting Standards (IND AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder.

For and on behalf of the Board of Directors

Dr. Avinash Chander

www.astramwp.com

Place: Hyderabad Date: 12.08.2022





બાળકોમાં પ્રિય એવા કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડીઓની પણ બોલબાલા

અંકલેશ્વરમાં પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેને ભાઈને રક્ષા બાંધી

અંકલેશ્વર,તા.૧૨

અંકલેશ્વર પંથક માં ભાઈ બહેન ની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વૃની હેતરૂપી ઉજવણી કરવામાં આવી હતી.

શ્રાવણ પૂનમ,એટલે બળેવ પૂર્ણિમા અને ખાસ કરીને રક્ષાબંધન ના પર્વ તરીકે ઉજવતા આ પવિત્ર તહેવાર પ્રસંગે બહેને વ્હાલસોયા ભાઈ ની કલાઈ પર રક્ષાબાંધી હતી. જ્યારે ભાઈએ પણ બહેનની રક્ષા કાજેનું અતૂટ વચન આપ્યુ હતુ. અતૂટ અને નિસ્વાર્થ ભાવ થી ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પ્રસંગે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હતી. અંકલેશ્વરમાં પોતાના વતન મળતા તેઓ ભાવુક હૃદય સાથે



કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડી ઓ ભાઈઓ ને પણ પોતાની બહેનનો નાના નાના ભુલકાઓમાં પણ ની પણ બોલબાલા જોવા મળી હસ્ત લિખિત પત્ર અને રાખડી

જ્યારે બાળકો માં પ્રિય એવા થી દૂર રોજીરોટી માટે રહેતા

પત્ર વાંચીને પોતાની કલાઈ પર રાખડી બાંધી હતી.આમ તો હવે સોશિયલ મિડીયા નો યુગ છે અને વાર તહેવારની શુભેચ્છા ઓ પણ તેના થકીજ પાઠવવા માં યુવા પેઢી માને છે,અને લગ્ન કે અન્ય શુભ અશુભ પ્રસંગોના આમંત્રણ પણ સોશિયલ મિડીયા ના માધ્યમ થી મોકલવામાં આવે છે, જ્યારે એક માત્ર રક્ષાબંધન પર્વ એવો છે કે બહેન હસ્ત લિખિત પત્ર અને તેમાં સુંદર રાખડીનું પરબીડિયુ બનાવીને પોસ્ટ કે કુરિયર ના માધ્યમથી મોકલે છે.એને ભાઈને પણ બહેન નું કવર મળતાજ હૈયું ભરાય આવે છે અને બહેન સાથે વિતાવેલી યાદોના સંસ્મરણો ફરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્ર વંદનાની સાથે સરદાર સાહેબનીવંદના

રાજપીપલા.તા.૧૨

ભારતના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે આગામી તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ દ્વારા સૌ પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં ધ્વજવંદન યોજાશે, આ અંગે ઉજવણીના સુચારૂ આયોજન અંગે ર્જીઇફ્રુપ્છ ના અધિક કલેકટર હિમાંશુ પરીખના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી,બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આ ઉજવણી સંદર્ભે સંબંધકર્તાઓને સોંપાયેલી જે તે જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે આ કાર્યક્રમ કાળજીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત મહાનુભવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનુ વેટેનરી ડોક્ટરએ શિંગડાના કેન્સર પીડિત બળદની સફળ સર્જરી કરી

ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં દસ ગામ દીઠ કરતું પશુ દવાખાનુ ૧૯૬૨ જીવીકે ઇએમઆરઆઈ ના વેટેનરી ડોક્ટરએ શિંગડાના કેન્સર પીડિત બળદની સફળ સર્જરી કરી હતી.

આમોદ તાલુકામાં માતર ગામમાંથી ત્રણ ઓગસ્ટના રોજ ભીમ રામભાઈ ૧૯૬૨ ઉપર કોલ નોંધાતા આમોદ તાલુકા માં આવી રહેલ ૧૦ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું તાત્કાલિક સારવાર માટે પહોંચી ગયા હતા ડોક્ટરે તપાસ કરતાં ખબર પડી હતી કે બળદને શિંગડાના કેન્સર છે ત્યાર પછી ઓપરેશન કરવાનો નિર્ણય લઈ આમોદ તાલુકાની ૧૯૬૨ ટીમમાં ડોક્ટર શિવ શંકર મોરિયા પાયલોટ વિજયભાઈ તથા ડોક્ટર મુબીન પટેલ અને પાયલોટ જગદીશભાઈ તેઓએ મળી સફળ સર્જરી કરી હતી અને બળદને કેન્સર મુક્ત કર્યો આ બદલ ફાર્મર દ્વારા ૧૯૬૨ની સેવાને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ રીતની સારી કામગીરી કરવાની પ્રેરણા તથા પશુપાલન નિયામક અધિકારીઓ દ્વારા હંમેશા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.



વેબસાઈટનું સર્વર ડાઉનની ફરિયાદ સંદર્ભે નિર્ણય

ઈન્ડિયન રેલવેએ વિદેશી કન્સલ્ટન્ટની નિમણૂક કરી



નવી દિલ્હી, તા.૧૨

ભારતીય રેલ્વે દેશના સામાન્ય લોકોના જીવનનો અભિન્ન ભાગ માનવામાં આવે છે. દરરોજ કરોડો યાત્રીઓ ટ્રેન દ્વારા તેમના ઘરે જાય છે. જો કે સામાન્ય રીતે રેલવે ટિકિટ બુક કરાવવા માટે લડાઈ થતી હોય છે, પરંતુ તહેવારોની સિઝનમાં આ લડાઈ વધુ વધી જાય છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરટીસીટીસી)ની ર્વેબસાઈટ પર ભીડને કારણે ઘણી વખત સર્વર ડાઉન થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ટિકિટ બુકિંગમાં મોટી સમસ્યા સર્જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંખ્યામાં ઈ-ટિકિટનો હિસ્સો જબરદસ્ત આઈઆરટીસીટીસીએ એક મોટું પગલું રીતે વધ્યો છે.

૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે

દેશ ''આઝાદી કા અમૃત મહોત્સવ''

ઉજવી રહ્યો છે, ત્યાં પેટ્રોલિયમ અને

કુદરતી ગેસ મંત્રાલયના નેજા હેઠળ

કારેલીબાગના અંબાલાલ પાર્ક ખાતે

આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં

ભર્યું છે. આઈઆરટીસીટીસીએ આ માટે વિદેશથી કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે. આ સાથે, તમને ઈ-ટિકિટ બુક કરાવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. આઈઆરટીસીટીસી સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને રેલવેએ આ પગલું ભર્યું છે.

તમને જણાવી દઈએ કે દુર્ગા પૂજા ૨૦૨૨, દિવાળી ૨૦૨૨, છઠ્ જેવા તહેવારો પર રેલ્વે ટિકિટ બુકિંગ માટે ઘણી હરીફાઈ છે. આવી સ્થિતિમાં કન્ફર્મ અને તત્કાલ ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત, બુકિંગ વખતે, મુસાફરો સર્વર ડાઉન હોવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં વિદેશી કંપનીને ઈ-ટિકિટ બુકિંગ માટે કન્સલ્ટન્ટ તરીકે રાખવાથી ભારે ભીડ વચ્ચે પણ સર્વર ડાઉનની સમસ્યા દૂર થઈ જશે. આ સાથે મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના તરત જ રેલવે ટિકિટ બુક કરી શકશે.

નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં કુલ આરક્ષિત ટિકિટોની

કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ સી આઈ એન: એલ૦૧૧૧૦જીજે૧૯૯૬પીએલસી૦૨૯૩૨૯

રજિ. ઓફિસ: 330, ટ્રિવિયા કોમ્પ્લેક્સ, નટુભાઇ સર્કલ, રેસકોર્સ, વડોદરા - ૩૯૦૦૦૭

છ-મેલ: girishshah@chemcrux.com કોન: ૦૨૬૫-૨૯૮૪૮૦૩/૨૯૮૮૯૦૩ વેબસાઇટ: www.chemcrux.com ૩૦મી જૂન ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ સ્ટેન્ડઅલોન નાણાકીય પરિણામોનો નિવેદન

		स्टेन्ड	ખલોન
ક્રમ નં.	વિગતો	૩૦મી જૂન ૨૦૨૨ ક્વાર્ટરના અંતે (અનઓડિટેડ)	૩૦મી જૂન ૨૦૨૧ ક્વાર્ટરના અંતે (અનઓડિટેડ
٩	કામગીરીમાંથી કુલ આવક (નેટ)	૨૭૧૪.૫૮	9536.99
£	સમયગાળા માટે યોખ્ખો નફો/ (નુકસાન) (કર પહેલાં, અપવાદરુપ અને/અથવા અસાધારણ વસ્તુઓ)	५१६.८०	૨૮૫.૪૨
3	સમયગાળા માટે યોખ્ખો નફો/ (નુકસાન) કર પહેલાં (અપવાદરૂપ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	५१६. ८०	૨૮૫.૪૨
٧	સમયગાળા માટે યોખ્ખો નફો/ (નુકસાન) કર પછી (અપવાદરુપ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	363.05	200.39
ч	સમયગાળા માટે કુલ સમગ્રહલક્ષી આવક [તે સમયગાળા માટે નફો/(નુકસાન) નો સમાવેશ કર પછી અને અન્ય સમગ્રહલક્ષી આવક કર પછી]	3८4.४૯	૨૦૩.૨૧
٤	ઇક્વિટી શેર મૂડી (ફેસ વેલ્યુ રુ. ૧૦/- પ્રતિ શેર)	9860.66	9860.66
9	પુનર્મૂલ્યાંકન અનામત સિવાયની અન્ય ઇક્વિટી	-	
۷	શેર દીઠ કમાણી (દરેક રુ. ૧૦ /-ની) ૧. મૂળભૂત (રુ.માં) ૨. પાતળું (રુ.માં)	ર.૫૯ ૧. ૩૫	9. 34 9. 34

૧. ઉપરોક્ત અનઓડિટેડ સ્ટેન્ડઅલીન નાણાકીય પરિણામોની ઓડિટ સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ૧૨મી ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ યોજાયેલી તેમની સંબંધિત બેઠકોમાં મંજૂર કરવામાં આવી છે. ૩૦મી જૂન ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના આંકડાઓ વૈધાનિક ઓડિટર્સ દ્વારા મર્યાદિત સમીક્ષાને આધિન છે.

ર. કંપની પાછલા વર્ષના અંત સુધી બી એસ ઈ (BSE) એસ એમ ઈ (SME) એક્સયેન્જમાં લિસ્ટેડ હોવાથી, તે ત્રિમાસિક નાણાકીય પરિણામો તૈયાર કરતી નું હતી. જો કે, નાણાકીય પરિણામો માટ્રે સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન્સની જરુરિયાતોને પહોંચી વળવા માટે, કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક નાણાકીય પરિણામો તૈયાર કર્યા છે અને તેમને ઇન્ડ એ એસ સુસંગત બનાવ્યા છે. પાછલા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાને લગતા આવા ઇન્ડ એ એસ સુસંગત આંકડાઓ ઓડિટર્સ દ્વારા સમીક્ષા/ઓડિટને આધિન કરવામાં આવ્યા નથી અને તે ફક્ત મેનેજમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીના આંધારે તૈયાર કરવામાં આવ્યા છે અને રજૂ કરવામાં આવ્યા છે. જો કે, આવા નાણાકીય પરિણામો તેની બાબતોનો સાયો અને ન્યાયી દૃષ્ટિકોણ પૂરો પાડે છે તેની ખાતરી કરવા માટે કંપનીના મેનેજમેન્ટે જરુરી યોગ્ય ખંતનો ઉપયોગ કર્યો છે.

3. ઉપરોક્ત સેબી (લિસ્ટિંગ અને અન્ય ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રૈગ્યુલેશન્સ, ૨૦૧૫ના નિયમન ૩૩ હેઠળ બીએસઇ સ્ટોક એક્સયેન્જ (બી એસ ઇ) સાથે ફાઇલ કરાયેલ ત્રિમાસિક નાણાકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો અર્ક છે. ત્રિમાસિક નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સયેન્જની વેબસાઇટ www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.chemcrux.com પર ઉપલબ્ધ છે.

તારીખ: ૧૨મી ઓગસ્ટ ૨૦૨૨

સહી/- ગિરીશકુમાર શાહ (હોલ ટાઈમ ડિરેક્ટર) (DIN: ००४६८२८१)

(भारत सरकार का उपक्रम)



ઝોનલ ઓફિસ સુરત, રીદ્ધિ શોપર્સ, સ્ટાર બજાર સામે, અડાજણ હજીરા રોડ, સુરત. ફોન નં. 0261-2797700. E-mail: zo.surat@ucobank.co.in

કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ વતી

ઈ-હરાજીથી વેચાણ : તા. 29-08-2022

સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટની કલમ 13(2) અને અન્વયે યુકો બેંકના અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ ખાતેદારોને બેંકના નીચે દર્શાવેલ લેશાં વ્યાજ સહિત વસુલ કરવા નોટીસ આપેલ, પરંતુ પછીથી લેશાં ચુકવવામાં નિષ્કળ રહેતા તેમની મિલકતનો કબજો લઈલીયો છે અને તે મિલકત 'જેમ છે, જ્યાં અને જે છે તેમ છે'ના ધોરણે વેચવાનો અધિકાર ધરાવે છે. જેથી બેંકના લેજાં અને વ્યાજ, અન્ય ખર્ચા જે નીચે પ્રમાણે છે તે વસુલ કરી શકાય. આ અંગે બેંકના નાણાં વસુલ કરતા સરફેસી એક્ટની કલમ 13(4) હેઠળ અને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સની કલમ સાથે વંચાકો લેતા મળેલ સત્તાની રૂએ તે મિલકત વેચવા માંગે છે. આ વેચાલ ઈ-હરાજી પ્લેટફોર્મથી વેબસાઈટ https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp પર કરવામાં આવશે

σi.	જામીનદારનું નામ	મિલકતની વિગત	કબજાનો પ્રકાર	અનેંસ્ટ મની ડીપોઝીટ	એકાઉન્ટ નં., સંપર્ક
32.	ક્લાસિક ટ્રેડર્સ - માલિક : અનિલ એમ. ચેતવાની	ક્લેટ નં. 305 અને 306, નવકાર એપાર્ટમેન્ટ, પરાગ રાજ સોસાયટી સામે, એસ્સાર પેટ્રોલ પંપ સામે, હરશી-વરાસીયારિંગ રોડ, વડોદરા.	રૂા.11,10,865.00 પ્રત્યક્ષ	રૂા.12,08,000/- રૂા.1,20,800/-	એમ.જી. રોડ, વડોદરા (0026) UCBA0000026 00261015020019 0265- 2415030 Mo. 8320708689
	સંક્રેત દિનેશભાઈ ભગત દિનેશભાઈ રજ્ઞછોડભાઈ પટેલ	રેવન્યુ સર્વે નં. 170/2, ટી.પી. સ્ક્રીમ નં. 27, ફાઈનલ પ્લોટ નં. 21/2, ફ્લેટ નં. 105, પહેલો માળ, A-2 ટાવર, સન ક્રેસ્ટ એપાર્ટમેન્ટ, ફોર્ચ્યુન-V પાસે, સન ફાર્મા રોડ, મોજે તાંડલજા, સબ ડીસ્ટ્રી. વડોદરા, જી. વડોદરા. બિલ્ટ અપ એરિયા : 752.97 ચો.ફ્રુટ.	રૂા. 22,90,813.92/- પ્રત્યક્ષ	રૂદ. 18,00,000/- રૂદ. 1,80,000/-	અલ્કાપુરી UCBA0001953 19531015020019 0265-2334566 M-8340277926 M-9430023818

સંપર્ક વિગતો અને સેવા પ્રદાતા વેબસાઇટ સરનામું, મિલકત સંબંધિત કોઈપજ્ઞ અન્ય ક્વેરી, ઝોનલ ઓફિસનો સંપર્ક કરી શકે છે. સંપર્ક નં. : 0261–2797700, ઈ-મેઈલ : zo.surat@ucobank.co.ir સોમવારથી શનિવાર કામકાજના સમય (સવારે 10:00 થી સાંજે 05:00 કલાક) દરમિયાન બેંક રજાના દિવસ સિવાય સંપર્ક કરી શકે છે.

કેન્કરાજીની શસ્ત્રો અને નિયમો : 1. ઈન્કરાજીની વધુ શસ્ત્રો માટે બીકરોએ તે બીકરોએ કેમ્કેલતા પહેલા અને ઈન્કરાજીમાં ભાગ હતા. પહેલા બેંકની વેબસાઈટ : https://www.msrcccommerce.com/suctionhome/fixpi/index.jsp અથવા www.ibspi.in જોઈ લેવી. 2. ભાગ લેનાર બીકરી પાસે માન્ય એક્ટીવ ઈમેઈલ આઈડી અને પાન કાર્ડ હોવો જરૂરી છે. 3. નીચે સહી કરનાર કોઈપણ જાતના કારજ કે નોટીસ આપ્યા વિના ઓફરો સ્વીકારવાનો, પાકળ પકેલવાનો કે બાકી રાખવાનો/વેચાણ રદ કરવાનો, નિયમો અને શસ્ત્રોમાં ફેસ્કાર કરવાનો સંપૂર્ણ હક્ક અબાધિત રાખે છે. 4. વેચાણ સરફેસી કાયદા / નિયમો 2002 અને ઉપર જણાવેલ શસ્ત્રોને આપિન રહેશે. 5. કારળ બિકરોએ ખરીદ કિમતના 25% (પહેલી ચુકરેલ ઈ.એમ. ડી. સબિકા) એક રાજીની પાકી ચેર કાર કરવાનો સંપૂર્ણ હક્ક અબાધિત રાખે છે. 4. વેચાણ સરફેસી કાયદા / નિયમો 2002 અને ઉપર જણાવેલ શસ્ત્રોને આપિન રહેશે. 5. કારળ બિકરોનના બાકી 75% રકમ વેચાણ અંગેની પુર્ણ કારમાં ભાવાનો રહેશે. જો ક્લું સુધ શિપોઝીટ જત થશે અને કસૂરવાર ખરીદનાર મિલક્ત અંગેના તામામ કે અન્ય ભાગમાં માટે લાવો કરી શકશે નહીં. 6. અસકળ બિકરોને ઈ.એમ. ડી. રકમ વેચાણ પહેલા પુરી 2કમ ચુકવરો તો વેચાણ રદ કરવામાં આવશે. 7. વેચાણ બેંકના પૃષ્ટીને આપિન સ્ટેશ, જો દેવાદાર (રો) / જામીનદાર (રો) વેચાય પહેલા પુરી 2કમ ચુકવરો તો વેચાણ રક કરવામાં આવશે. 8. મારફત દેવાદાર (રો) / જમીનદાર (રો)ને નોટીસ આપવામાં આવશે છે કે ત્યાર કર્યા મારફ કરવામાં આવશે. 9. ઓનલાઈન બીક ભરવાનો એક લી તારીખ પહેલા નથશે તો હરાજીની સારીખ હતા રાગે કે જાતા કરવા કરવામાં આવશે. 9. ઓનલાઈન બીક ભરવાનો એક લી લાસીખ ત્યાર કરવા કરવાનો અપ્યો કરવા કરવાનો એક લાસ કરવા કરવા કરવા કરવાનો અપ્યો છે. અપાયા કરક કરવામાં આવશે. 9. ઓનલાઈન બીક ભરવાની એક લાસ કરવાના કરે હો 2022 , સાંજે :04.00 કલાક સુધી રહેશે. 10. ભિંડ રજૂ કરવાની કિંમત રિઝર્વ પ્રાર્પસથી ઉપરની હોવી જોઇએ અને બોલી વધારાની કિંમત રૂા. 10,000/- રહેશે. 11. ટીડીએસ જો લાગુ પડેતો બીડરે ચુકવવાનું રહેશે. તા. 12-03-2022 | સ્થળ : સુરત-યુકો બેંક.

Extract of Standalone and Consolidated Financial Results (Unaudited) for the Quarter ended June 30, 2022

શર્મા, મેનેજર-એન્જિનિયરિંગ, ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. રાજકીય અસ્થિરતા પશ્ચિમ રેલવે વચ્ચે બ્રિટનનું અર્થતંત્ર પશ્ચ મંદીના ભરડામાં

HPCL પેટ્રોલ પંપ ખાતે પ્રદર્શનનું ભાગલા દરમિયાન પરિવારો સાથે

"ભાગલાની ભયાનકતા" પ્રદર્શિત હતી, આ ઉપરાંત સ્વતંત્રય સેનાની

કરાઈ છે. જેનું મુખ્ય અતિથિ સ્વ.શ્રી ચંદુભાઈ પટેલ 'ઘોડા ફાડ'ના

દુર્ગાપ્રસાદ સિંહજીએ ઉદ્ઘાટન કર્યું. ૯૫ વર્ષના ધર્મપત્ની શાંતાબેન

આ પ્રસંગે ડેપ્યુટી જનરલ મેનેજર પટેલનું નિવાસસ્થાને જઈને સન્માન

- બરોડા પ્રાદેશિક કચેરી, વિશાલ કર્યું હતું. આ પ્રદર્શનો ૧૪

વડોદરાના પેટ્રોલપંપ પર ભાગલાની

ભયાનકતા દર્શાવતું પ્રદર્શન યોજાયું

અમદાવાદ, તા.૧૨ વૈશ્વિક મોંઘવારીની રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મંદીના ધકેલાયું ભરડામાં છે. સત્તાવાર આર્થિક આંકડા અનુસાર બીજા ત્રિમાસિકગાળામા<u>ં</u> બ્રિટનની અર્થવ્યવસ્થા સંકોચાઈ હતી. રાજકીય અસ્થિરતા વચ્ચે દેશનું અર્થતંત્ર પણ હવે ઝોલા ખાઈ રહ્યું છે.

શુક્રવારે જાહેર થયેલ બીજા ત્રિમાસિકગાળાના વૃદ્ધિદરના આંકડા અનુસાર બ્રિટનનો જીડીપી દર પ્રથમ કવાર્ટરના ૦.૮ ટકાના વધારાની સામે એપ્રિલ-જૂન સમયગાળામાં ૦.૧ ટકા ઘટ્યો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે આ આંકડા જાહેર કર્યા હતા.

ડબલિંગ કામ

શ્રીમતી વિજયા પ્રિયદર્શિની અને

મેનેજર-માર્કેટિંગ, શ્રીમતી શ્રદ્ધા

શ્રીવાસ્તવની હાજરીમાં મુખ્ય

અતિથિનું સન્માન કરવામાં આવ્યું

હતું. આ પ્રદર્શનમાં ૧૪ ઓગસ્ટ

૧૯૪૭ના રોજ ભારત-પાકિસ્તાનના

થયેલી દુર્ઘટનાઓ દર્શાવવામાં આવી

નાયબ મુખ્ય સિગ્નલ એન્ડ ટેલિકોમ

એન્જિનિયર (બાંધકામ) બીઆરસી, નીચે આપેલ વિગતો મુજબ નિયત ફોર્મમાં સીલબંધ કવરમાં ખુલ્લા ટેન્ડરો આમંત્રિત કરે છે: ટેન્ડર નંબર: S&T/C/ BRC/117-R1/2022-23 Sig તારીખઃ ९२-०८-२०२२; स्थान साथेना तेना डामनुं નામઃ આણંદ ગોધરામાં ઇન્ટરલોક કરેલ એલસી ગેટની જોગવાઈ આણંદથી તાશારા વિભાગમાં ડબલિંગ કાર્ય અને વડોદરા ડિવિઝન, પશ્ચિમ રેલ્વેના ડબલિંગ કામ માટે એલસી ગેટ, લોકેશન બોક્સ, સિગ્નલ અને કેબલના ઉલ્લંઘનને દૂર કરવા/શિફ્ટ કરવા. આશરે. કામની કિંમતઃ રૂ. હ, ૫૪, ૨૬, ૧૬૧. ૨૬ (સાત કરોડ ચોપન લાખ છવીસ હજાર એકસો એકસઠ રૂપિયા અને છવ્વીસ પૈસા માત્ર). જમા કરાવવાના બાનું: રૂ. ૫, २७, ૧૦૦/- (પાંચ લાખ સત્તાવીસ હજાર અને સો માત્ર); ઓફરની માન્યતાઃ ટેન્ડર ખોલવાની તારીખથી ૬૦ દિવસ. ઈ-ટેન્ડર રજૂઆત કરવાની અને ઈ-ટેન્ડર ખોલવાની તારીખ અને સમય: ૧. રજૂઆત અને ખોલવાની અગાઉની તારીખ તા. ૦૨-૦૯-૨૦૨૨. ૨. રજુઆતની સુધારેલી તારીખ તા. ૦૮-૦૯-૨૦૨૨ નાં રોજ ૧૫.૦૦ કલાક સધી. અને ખોલવાની તારીખ તા. ૦૮-૦૯-૨૦૨૨ ૧૫.૩૦ કલાકે. વેબસાઇટ વિગતો અને સ્થળ માટેની સૂચના જ્યાં સંપૂર્ણ વિગતો જોઈ શકાય છે વગેરેઃ http://www.ireps.gov.in નાયબ મુખ્ય સિગ્નલ એન્ડ ટેલિકોમ એન્જિનિયર (બાંધકામ), બીજો માળ, એનેક્સ બિલ્ડીંગ, ડીઆરએમ ઓફિસ, પ્રતાપનગર, પશ્ચિમ રેલવે, વડોદરા-૩૯૦૦૦૪.

Place: Chennai

Date: August 12, 2022

HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED

Registered Office: 'HOEC House', Tandalja Road, Off Old Padra Road, Vadodara-390 020. Website: www.hoec.com Email: hoecshare@hoec.com CIN: L11100GJ1996PLC029880

Sr.		Standalone			Consolidated				
No.	Particulars	Quarter ended			Year ended	Quarter ended			Year ended
WO.		June 30, 2022	Mar. 31,2022	June 30,2021	March 31, 2022	June 30, 2022	Mar. 31,2022	June 30,2021	March 31, 202
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations	7,019.46	4,432.18	2,756.23	14,730.88	9,104.20	4,362.66	3,179.22	16,718.9
2	Net Profit/(Loss) for the period (before tax and exceptional items)	3,421.19	2,347.15	1,171.04	7,019.04	3,270.50	764.93	1,135.95	5,405.0
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional items)	3,421.19	(1,089.38)	1,171.04	3,582.51	3,270.50	(2,671.60)	1,135.95	1,968.4
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional items)	3,421.19	(1,089.38)	1,171.04	3,582.51	3,235.07	(2,721.14)	1,110.22	1,999.3
5	Total Comprehensive Income/(Loss) for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income/ (Loss) (after tax)]	3,420.18	(1,096.61)	1,172.10	3,578.45	3,234.06	(2,728.37)	1,111.28	1,995.3
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.9
7	Reserves				63,370.57				62,086.3
8	Earnings Per Share (Face value of ₹ 10/-each) (not annualized) Basic EPS ₹ Diluted EPS ₹	₹ 2.59 ₹ 2.59	(₹ 0.82) (₹ 0.82)	₹ 0.89 ₹ 0.89	₹ 2.71 ₹ 2.71	₹ 2.45 ₹ 2.45	(₹2.06)	₹ 0.84 ₹ 0.84	₹ 1.5

The above is an extract of detailed format of quarterly financial results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly financial results is available on the stock exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website

> BY ORDER OF THE BOARD For Hindustan Oil Exploration Company Limited P. Elango R. Jeevanandam Managing Director Director & CFO DIN No 07046442 DIN No 06475821

CHANGE OF NAME

I no 13995524-A Rank Ex-HAV Name Patel Harishbhai Natvarbhai, Presently Residing At and Post Toraneya, Taluka - Mahudha, Dist. Kheda, Gujarat, I have changed my son name from AAYUSH to PATEL AAYUSH HARISHBHAI

For all Purposes Affid.No. IN-GJ1062531559955 Dated 08.08.2022

Name Patel Harishbhai Natvarbhai, Presently Residing At and Post Toraneya, Taluka - Mahudha, Dist Kheda, Gujarat, I have changed my wife name from

Pritibain Harshbhai Patel to Pritiben Harishbhai Patel. For all Purposes.

0010	Dated 04.08.2022
પશ્ચિમ	રેલવે

ઝ. ળં.	વસ્તુઓનું ટૂંકું વર્ણન	જસ્થો	તારીખનો સમય
660	બેંકશૂ	ર૦૨૨૦નંગ	૨૯-ઓગસ્ટ-૨૨
rea	લાંબા જીવનસાઇડ બફર એસેમ્બલી	૩૩૨નંગ	૨૯-ઓગસ્ટ-૨૨
865	સામાન્યહેતુ મશીનરી તેલ Gr.VG-100	૨૬૯.૧૩ કે.એલ	રહ-ઓગસ્ટ-૨૨
£53	નટ, સ્થિંગ વોશર અને ૪ ડાયા. સ્પ્લિટ પિન સાથે કીઓલ્ટ	११३७हर्नम	૩૦-ઓગસ્ટ-૨૨
rer	ગૌલ વર્ટિકલ ડેમ્પર	પહરનંગ	3૧-ઓગસ્ટ-૨૧
864	બોલીઓલ્સ્ટરસ્પ્રિંગસસ્પેન્શન માટે હેન્ગર	ર૭૦૦નંગ	૦૫-સર્પ્ટમ્બર-૨૨
ree	૪ મીમી ડાવા મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડીંગ	૩૯૮૩૭૨ મીટર	૦૯-સપ્ટેમ્બર-૨૨

શુદ્ધિપ્રભ્ર રિવર્સ ઓક્શન ક્રમ નંબર ૧૫ પર ટેન્ડર નોટિસ નંબર એસ/૧૯/૨૦૨૨ તારીખ ૧૦-૦૬-૨૦૨૨ માટે ૨૮-૦૬-૨૦૨૨ થી ૨૨-૦૮-૨૦૨૨ સુધી મુલતવી રાખવામાં આવી છે (કેસ્નબ બોગીઝ માટે સંશોધિત

શુદ્ધિષ્ત્ર : ક્રમ નંબર ૩૦૯ (સાંકડા જડબાના એડેપ્ટર વર્ગ E-6X11 CTRB) પર ટેન્ડર નોટિસ નંબર એસ/૨૦/૨૦૨ૂર તારીખ ૨૦-૦૬-૨૦૨૨ માટે તારીખ ૧૮-૦૭-૨૦૨૨ થી ૨૨-૦૮-૨૦૨૨ સુધી મુલતવી સભ્યામાં જાયાંછ. શુદ્ધિપ્રક્ષ: કમ નેબર ૩૪૯ પર ટેન્ડર નોટિસ નંબર એસ/૨૧/૨૦૨૨ તારીખ ૨૮-૦૬-૨૦૨૨ માટે ૨૫ ૦૭-૨૦૨૧ થી ૨૨-૦૮-૨૦૨૨ સુધીની નિયત તારીખ મુલતવી રાખવામાં આવી છે (CC PU સાઇ

બેરરપેડએસે. પૂર્ણ) વિગતવાર સૂચના ઈએમડી, ખુરીદી પ્રતિબંધો અને વિગતવાર ટેન્ડર શરતો અંગે, કૃષા કરીને વેબસાઇટ

બાન્કો પ્રોડક્ટસ (ઈન્ડિયા) લિમિટેડ

બીલ, ભાચલી રેલ્વે સ્ટેશનની પાસે, પાદરા રોડ, જિલ્લો : વડોદરા - ૩૯૧૪૧૦. होन नं.: (०२९५) २३१८२२९, हेड्स नं.: (०२९५) २९८०४३३ ઈ-એલ : investor@bancoindia.com • વેબસાઈટ : www.bancoindia.com CIN: L51100GJ1961PLC001039

આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીના સદસ્ચોની ૬૧મી વાર્ષિક સાધારણ સભા

(એજીએમ) ગુરૂવાર, રસમી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ, સવારના ૧૦.૩૦ વાગે (આઈએસટી), કંપનીઝ એક્ટ, ૨૦૧૩ (એક્ટ) અને સિક્યુરીટીઝ એન્ડ એક્સર્ચેજ ાર્ટ ઓક દાલ્ડિયા (લીર્સ્ટીંગ ઓલ્લીગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયર્સેટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ની જોગવાઈઓ તેમજ મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા જારી કરવામાં આવેલા જનરલ સર્કચુલર નં. ૧૪-૨૦૨૦, તા.૮મી એપ્રિલ, ૨૦૨૦ જનરલ સર્કયુલર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને જનરલ સર્કયુલર નં. ૦૨/૨૦૨૧, તા.૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ અને જનરલ સર્કચુલર નં. ૦૨/૨૦૨૨, તા.પમી મે, ૨૦૨૨ અને સર્કચુલર નં. સેબી/એચઓ/સીએફડી/સીએમડી૧/સીઆઈઆર/પી/૨૦૨૦/૭૯ તા.૧૨મી મે, ૨૦૨૦ ના સર્ક્યુલર ના સેબી/એયઓ/સીએફડી/સીએમડી૧/સીઆઈઆર/પી/૨૦૨૦/૧૧ તા.૧૩મી મે, ૨૦૨૨ જે સેબી હારા બહાર પાડવામાં આવ્યા છે, તેમાં દરાવિલી કાર્ચ पध्धतिने अनुसरीने विडीयो डोन्ड्रन्सींग तेमक अन्य ओडीओ विज्रयुअस मीन्स (ઓએવીએમ) થી મળશે.

એજીએમ યોજવાની સૂચના સહિતનો કંપનીનો વાર્ષિક અહેવાલ જેમાં વીસી/ઓએવીએમના માધ્યમથી વાર્ષિક સાધારણ સભામાં ભાગ લેવા તેમજ ઈ-વોર્ટીંગ કરવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી છે, તે ફક્ત કંપનીના એવા સદસ્ચોને, જેમના ઈમેઈલ સરનામા કંપનીમાં/ડિપોજીટરીમાં નોંઘાવેલા છે તેમને મોકલવામાં આવશે. કંપનીની વેબસાઈટ <u>www.bseindia.com</u>, સ્ટોક એક્સર્ચેજની વેબસાઈટ એટલે કે બીએસઈ લિમિટેડની વેબસાઈટ www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ www.nseindia.com અને મે/સ લીન્કઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિમિટેડની વેબસાઈટ (આરટીએ) https://instavote.linkintime.co.in પર પણ વાર્ષિક અહેવાલ ઉપલબ્ધ રહેશે.

જે સદસ્ચો ફિઝીકલ મોડમાં શેર્સ ઘરાવે છે, તેમને વડોદરા ખાતે કંપનીના આરટીએને vadodara@linkintime.co.in પર ઈમેલથી ફોલીયો નંબર, શેરધારકનું નામ જેવી વિગતો મોકલવા વિનંતી છે. ડિમેટ સ્વરૂપમાં શેર ધારણ કરતાં હોય તેવા શેરધારકોને તેમના સંબંધિત ડિપોજીટરી પાર્ટીસીપન્ટસ પાસે અથવા કંપનીના વડોદરા ખાતેના આરટીએને vadodara@linkintime.co.in ઇમેઈલથી ઈમેલ આઈડી, પાનકાર્ક અને બેંક ખાતાની વિગતો અદ્યતન કરાવી લેવા વિનંતી કરવામાં આવે છે.

ડિવિડન્ડ પર ટીડીએસની કપાત

ઈન્કમટેક્સ એક્ટ. ૧૯૬૧ની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર તા.૧લી એપ્રિલ, ૨૦૨૦ પછી કંપનીએ શેરધારકોને ચૂકવવામાં આવતા ડિવિડન્ડસ પર ઠરાવેલા દરે સ્ત્રોત પર કરકપાત (ટીડીએસ) કાપવો જરૂરી છે. કર કપાતનો દર શેરધારકોના નિવાસી દરજની તેમજ તેમણે રજુ કરેલા અને કંપનીએ સ્વીકારેલા દસ્તાવેજો પ્રમાણે જુદો જુદો રહેશે. તેથી, સદસ્યોને તેમના પાનની વિગતો અદ્યતા કરાવી લેવા અને લાગુ પડતા દસ્તાવેજો અપલોડ કરવા જણાવવામાં આવે છે. ઉંચ દરે કરની કપાત ટાળવા નીચે જણાવેલ પ્રક્રિયાને અનુસરીને અથવા કંપનીને ઈમેઈલ દ્વારા અથવા તેના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટસને આપવામાં આવેલા ઇમેઈલ આઈડીઝ દ્વારા આ પ્રક્રિયા કરવા જણાવવામાં આવે છે.

સદસ્યોને આવશ્યક દસ્તાવેજો જેમ કે ફોર્મ ૧૫૭/૧૫એચ, સેક્સન ૧૯૬ હેઠળના દસ્તાવેજો, ૧૯७ हेहળના દસ્તાવેજો, એફપીઆઈ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, ટેક્સ રેસીડેન્સી સર્ટીફિકેટ, લોઅર ટેક્સ સર્ટીફિકેટ અપલોડ કરવા માટે કંપનીના રજસ્ટ્રાર अने शेर दान्सइर એજन्टनी वेजसाईट लींड ईनटाईभ ईन्डिया प्रा. लिभिटेड ("એલઆઈઆઈપીએલ") પર જોવા અને ઉપર જણાવેલા દસ્તાવેજો https://web.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html 42 અપલોડ કરવા વિનંતી છે જેથી કંપની લાગુ પડતો સમુચિત કર કપાત દર ટીડીએસ / વીથ हોલીંગ ટેક્સ રેટ નિર્ઘારીત કરી શકે.

બિન નિવાસી ભારતીયો - એનઆરઈને નીચે જણાવેલી લીંકની મદદથી એકોબેટ રીકરમાંથી ઘી ફોર્મ ઓફ ઈન્ડિયા વીથઠોલ્ડીંગ ટેક્સ ડિકલેરેશન ફોર એફ.વાય. ૨૦૨૨-૨૩ ઠાઉનલોઠ કરીને ખોલવા પિનંતી છે. http://mail.bancoradiator.com/upload/formindian withholding tax declaration.pdf અને તેને કંપનીને ઈમેઈલ એ ડ્રેસ taxation@bancoindia.com, investor@bancoindia.com અને sec@bancoindia.com પર ઈમેલથી મોકલવા અથવા તેના રજીસ્ટ્રાર અને द्रान्सइर अेषन्टने तेमना टेक्स रेसीडेन्सी सर्टी हिंडेट ઉपरांत आपपामां આવેલા ઈમેલ આઈડીથી મોકલવા જણાવવામાં આવે છે.

વતી બાન્કો પ્રોડક્ટસ (ઇન્ડિયા) લિમિટેડ

પૂજા ગુરનાની કંપની સેકરેટરી સ્થળ : બીલ તારીખ: ૧૨.૦૮.૨૦૨૨











